

ત્વરિત જાહેરાત માટે

## ડિજિટલ ડોર્સ ઓપન બ્રેમ્પટનના બીજા વર્ષના આયોજન મારફતે દરેક ડોર પાછળની વાર્તા શોધો

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (સપ્ટેમ્બર 23, 2021) – સપ્ટેમ્બર 27 થી ઓક્ટોબર 31 સુધી, રહેવાસીઓ અને મુલાકાતીઓ પોતાના ઘરની સગવડમાંથી, ડિજિટલ ડોર્સ ઓપનના બીજા વર્ષ માટે બ્રેમ્પટનનો ઇતિહાસ, વારસો ધરાવતા અને અજોડ સાંસ્કૃતિક સ્થળોનો અનુભવ કરી શકે છે.

બ્રેમ્પટન આસપાસના 20 થી વધારે સ્થળોની વર્ચ્યુઅલ ટૂર્સ, વીડિયો અને ફોટામાં સહભાગી થાવ જે આ સમગ્ર પ્રોવિન્સને આવરી લેતા આયોજનમાં બ્રેમ્પટનનો સમૃદ્ધ વારસો અને હરિયાળા સ્થળોને દર્શાવે છે. આ વર્ષે નવું, સ્થળોની ઝાંખીમાં જોવા મળશે હરિયાળી પહેલવાળી ઈમારતો, ટ્રેઈલ્સ (પગદંડીઓ), પાર્ક્સ, બીચીસ, સરોવરો, સંરક્ષણ વિસ્તારો અને સમગ્ર બ્રેમ્પટનના હરિયાળા પાડોશ. પાનખર ઋતુના રંગોનો આનંદ માણવા શ્રેષ્ઠ સ્થળ શોધી કાઢો અને અમારા 2021 નર્ચરિંગ નેબરહૂડ્સ પ્રોગ્રામની વર્ચ્યુઅલ ટૂર્સમાં ભાગ લો.

સંપૂર્ણ અનુભવ માટે વેબસાઈટ જુઓ, [brampton.ca/doorsopen](http://brampton.ca/doorsopen)

ઓન્ટેરિયો હેરિટેજ ટ્રસ્ટ પોતાના અજોડ અને સૌથી મનમોહક સાંસ્કૃતિક સ્થળોના ડોર્સ, ગેટ્સ અને કોર્ટયાડ્સ ખોલવા સમગ્ર પ્રોવિન્સના સમુદાયો સાથે કામ કરે છે, જેથી તમે આંતરિક વાર્તાઓની શોધખોળ કરી શકો છો. વિગતો માટે વેબસાઈટ જુઓ, [doorsopenontario.on.ca](http://doorsopenontario.on.ca).

### અવતરણો (ક્વોટ્સ):

“બ્રેમ્પટન સમૃદ્ધ, સાંસ્કૃતિક વારસો ધરાવતી રચના (મોઝેઈક) છે અને હું ડિજિટલ ડોર્સ ઓપનના બીજા વર્ષ માટે આ સ્થળોનો પ્રવાસ કરવા દરેક વ્યક્તિને પ્રોત્સાહિત કરું છું. આ ઓનલાઈન આયોજન તમને તમારા પોતાના ઘરની સગવડમાં રહીને બ્રેમ્પટનના સૌથી પ્રિય સ્થળોની મુલાકાત લેવાની તક આપે છે.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“ડિજિટલ ડોર્સ ઓપન લોકોને બ્રેમ્પટન આસપાસના અને સમગ્ર પ્રોવિન્સના સ્થળો ખોળવાની તક આપીને, અજોડ અનુભવ કરાવે છે. અમારી હરિયાળી પહેલ અને આઉટડોર સ્થળોની ઝાંખી કરાવતા બ્રેમ્પટનના કેટલાક સૌથી રસપ્રદ સ્થળોની ટૂર્સ, વીડિયો અને ફોટા તપાસવા અમારા ઓનલાઈન હબની મુલાકાત ચોક્કસપણે લેશો.”

- હરકિરત સિંહ (Harkirat Singh), સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 9 અને 10; પ્રમુખ, કોર્પોરેટ સર્વિસીસ, સીટી ઓફ બ્રેમ્પટન

“સીટી ઓફ બ્રેમ્પટનના કર્મચારીઓએ ડિજિટલ ડોર્સ ઓપન બ્રેમ્પટનના બીજા વર્ષ માટે ઉત્કૃષ્ટ ઓનલાઈન અનુભવ સર્જ્યો છે. શહેરના સમૃદ્ધ ઐતિહાસિક અને સુંદર આઉટડોર સ્થળો વખાણો, અને તમે અગાઉ ક્યારેય ન જોયા હોય તેવા સ્થળોની આહવાદકતા પર નજર કરો.

આ એક વર્ચ્યુઅલ આયોજન છે જેને તમે ચૂકી જવાનું ઈચ્છશો નહીં!”

- ડેવિડ બારિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે [www.brampton.ca](http://www.brampton.ca).

**મિડિયા સંપર્ક :**

પ્રભજોત કૈથ (Prabhjot Kainth)

કોર્ડિનેટર, મીડિયા એન્ડ કમ્યુનિટી એન્ગેજમેન્ટ

સ્ટ્રેટેજિક કમ્યુનિકેશન

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | [Prabhjot.Kainth@brampton.ca](mailto:Prabhjot.Kainth@brampton.ca)